

RAN-1801130701040001 / 2501005501040001
M. A. (Sem.-I) Examination April - 2026
Economics : Industrial Economics-I (EC-1)
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book (2) પ્રશ્ન 1 ફરજિયાત છે. Question 1 is compulsory. (3) જમણી બાજુ દર્શાવેલા અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે. Figure of the right indicate full marks of the questions. (4) As per the instruction no. 1 of page no. 1.	Seat No.: Student's Signature
--	--

- પ્ર.1. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 10**
1. પેઢીના વિવિધ હેતુઓ જણાવો
 2. બજાર પ્રવેશ સામેના અવરોધો કયા છે?
 3. ભારતમાં કંપનીઓના વિલીનિકરણના બે ઉદાહરણ જણાવો.
 4. પેઢી અને ઉદ્યોગનો અર્થ જણાવો.
 5. પેઢીની વૃદ્ધિ એટલે શું?
- પ્ર.2. ઔદ્યોગિક અર્થશાસ્ત્ર એટલે શું? ઔદ્યોગિક અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્રની ચર્ચા કરો. 13**
- અથવા**
- પ્ર.2. અ. વસ્તુ વિભિન્નતા 07**
બ. બજારમાળખું અને નવપ્રવર્તન 06
- પ્ર.3. ઉત્પાદન મૂલ્ય નિર્ધારણની ખર્ચ વત્તા કિંમત નિર્ધારણની પદ્ધતિ સમજાવો. 13**
- અથવા**
- પ્ર.3. ઔદ્યોગિક ઉત્પાદકતાનો ખ્યાલ સમજાવી તેને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. 13**
- પ્ર.4. ટૂંક નોંધ લખો (કોઈ પણ બે) 14**
1. બહુરાષ્ટ્રીય કંપનીના લાભ-ગેરલાભ
 2. વેચનારાઓનું કેન્દ્રીકરણ
 3. ઔદ્યોગિક અસમતુલા
 4. ડાઉનીનો પેઢીની વૃદ્ધિનો સિદ્ધાંત

ENGLISH VERSION

- Q.1. Answer the following questions in brief. 10**
1. State the various purposes of a firm.
 2. What are the barriers to market entry?
 3. Give two examples of merger of companies in India.
 4. State the meaning of firm and industry.
 5. What is firm growth?
- Q.2. What is Industrial Economics? Discuss the nature and scope of industrial economics. 13**
- OR**
- Q.2. A. Product differentiation 07**
B. Market structure and innovation 06
- Q.3. Explain cost plus pricing method of product pricing. 13**
- OR**
- Q.3. Explain the concept of industrial productivity and discuss the factors affecting it. 13**
- Q.4. Write a short note (any two) 14**
1. Advantages and Disadvantages of Multinational Companies
 2. Concentration of sellers
 3. Industrial Disequilibrium
 4. Downie's growth theory of firm.
-